

(CIN - L24231GJ1998PLC034094)

Regd. Office: 7th Floor, Hasubhai Chambers, Opp. Town Hall, Ellisbridge, Ahmedabad- 380006, Phone No. (O) 079-26574371/72/73, (F) 079-26574374, Email: info@kiriindustries.com website: www.kiriindustries.com

Extract of Statement of Consolidated Financial Results for the Quarter and Half Year ended September 30, 2023							
			(Rs. in Lakhs)				
	Quarter	Ended	Half Year Ended				
Particulars	(30/09/2023)	(30/09/2022)	(30/09/2023)				
	(Unaudited)	(Unaudited)	(Unaudited)				
Total income from operations	23,249.78	24,232.50	46,124.52				
Net Profit/ (Loss) for the period (before tax,							
exceptional and/or extraordinary items)	(2,557.70)	(2,046.94)	(3,852.29)				
Net Profit/ (Loss) for the period before tax							
(after Exceptional and/or Extraordinary items)	(2,557.70)	(2,046.94)	(3,852.29)				
Net Profit/ (Loss) for the period after tax (after							
Exceptional and/or Extraordinary items)	(2,679.60)	(2,617.00)	(4,206.65)				
Total Comprehensive Income for the period							
[Comprising Profit/(Loss) for the period (after tax)							
and Other Comprehensive Income (after tax)]	1,879.48	6,065.87	1,625.17				
Paid up Equity Share Capital	5,183.42	5,183.42	5,183.42				
Reserves (excluding Revaluation Reserve) as							
shown in the Audited Balance Sheet of the							
previous year.	-	-	-				
Earnings Per Share							
(Face value of Rs. 10/- each)							
Basic:	3.63	11.70	3.14				
Diluted:	3.63	11.70	3.14				

Extract from the Standalone Financial Results for the Quarter and Half Year ended Septe (Rs. in Lakhs) **Quarter Ended** Half Year Ended **Particulars** (30/09/2023) | (30/09/2022) | (30/09/2023) (Unaudited) (Unaudited) (Unaudited) Total income from operations 15.129.90 14.084.09 31,789.82 Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) (3,500.86)(4,412.68)(3,732.49)Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) (3,414.07)(4,390.62)(3,542.13)

- 1. The above is an extract of the detailed Unaudited Quarterly Financial Results ("Results") filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on the website of Stock Exchanges (www.bseindia.com & www.nseindia.com) as well as on the Company's website (www.kiriindustries.com) 2. The Statutory Auditors of the company have carried out a "Limited Review" of the above
- results as per Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. 3. The above Results were reviewed by the Audit Committee and thereafter approved by the
- Board of Directors at their meeting held on November 08, 2023

By order of the Board of Directors

For Kiri Industries Limited Manish Kir Chairman & Managing Director

NESTLÉ INDIA LIMITED

(CIN: L15202DL1959PLC003786)

Regd. Office: 100 / 101, World Trade Centre, Barakhamba Lane, New Delhi-110 001 Email: investor@in.nestle.com | Website: www.nestle.in | Ph: 011-23418891

NOTICE OF POSTAL BALLOT/ E-VOTING

Members are hereby informed that pursuant to Sections 110, 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act"), Rule 22 and Rule 20 of the Companies (Management and Administration) Rules 2014, read with the General Circular Nos. 14/2020 dated 8th April 2020, 17/2020 dated 13th April 2020, 9/2023 dated 25th September 2023 and other relevant circulars, issued by the Ministry of Corporate Affairs, Government of India ("MCA Circulars"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standard on General Meetings ("SS-2") issued by the Institute of Company Secretaries of India ("ICSI") as amended, the Company has completed dispatch of Postal Ballot Notice dated 19th October 2023 ("the Notice") along with Explanatory Statement on 7th November 2023 only through electronic mode to all those members of the Company whose emai address was registered with the Company/ Depository Participant(s) as on Wednesday, 1st November 2023 ("Cut-off date"). The requirement for sending physical copy of the Notice and Postal Ballot Form has been dispensed with vide relevant MCA Circulars.

Members are hereby informed that:

- a. the Special Business pertaining to the sub-division/split of equity shares of the Company, such that 1(One) equity share having face value of Rs. 10/- (Rupees Ten only) each, fully paid-up, be sub-divided into 10 (Ten) equity shares having face value of Re. 1/- (Rupee One only) each, fully paid-up, by alteration of Clause 5 of the Memorandum of Association of the Company, to be transacted by means of Postal Ballot by voting through electronic means only ("remote e-Voting"). The remote e-Voting facility is provided by National Securities Depository Limited ("NSDL");
- the remote e-Voting period commences on Thursday, 9th November 2023 at 9:00 A.M. (IST) and will conclude on Friday, 8th December 2023 at 5:00 P.M. (IST), thereafter, the remote e-Voting module shall be disabled by NSDL and e-voting shall not be allowed beyond the said time. Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently;
- only those members, whose names appear in the Register of Members of the Company or in the Register of Beneficial Owners maintained by the Depositories, as on Cut-off date are entitled to cast their votes on the

the members who have not received the Notice, may write to investor@in.nestle.com and obtain the same; and

- for any query or grievance connected with the voting by electronic means, members may refer to the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-Voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on 022-4886-7000 and 022-2499-7000 or contact Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL, 4th Floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lowel Parel. Mumbai-400 013. at the designated email ID: evoting@nsdl.co.in, who will also address the grievances connected with the facility for remote e-Voting. Members may also write to the Company Secretary at the Company's email ID: investor@in.nestle.com
- Members, who have not registered/updated their email address with the Company or their Depository Participant, may complete the email registration process as under:
- Members holding shares in physical form, may register/ update their e-mail address by submitting duly filled and signed request letter in Form ISR-1 along with self-attested copy of the PAN Card linked with Aadhaar; and self-attested copy of any document (such as Aadhaar Card, Driving License, Election Identity Card, Passpor etc.) in support of the address of the member and such other documents as prescribed in the Form ISR-1, by e-mail at investor@in.nestle.com followed by mandatorily sending the physical copy of the same through post at the Registered Office of the Company; and
- Members holding shares in demat form, can update their email address with their Depository Participant(s).

The Company has sent reminders to all those members who have not completed their KYC with the Company/ Depository Participant(s). In terms of SEBI Circular, members holding shares in physical form but have no completed their KYC, are once again requested to complete their KYC by 31st December 2023, in order to continue to receive corporate benefits on their equity shares including receipt of new share certificate(s) upon sub-division/ split of equity shares. Members may refer the process provided under the Notes to the Postal Ballot Notice dated 19th October 2023, in order to complete the KYC details.

The Notice is also available on the website of the Company (www.nestle.in), National Stock Exchange of India Limited (www.nseindia.com), BSE Limited (www.bseindia.com) and NSDL (www.evoting.nsdl.com)

Result of Postal Ballot shall be declared by Monday, 11th December 2023, and shall be placed along with the Scrutinizer's Report on the Company's website at www.nestle.in, displayed on the Notice board of the company at Registered Office and shall be communicated to National Stock Exchange of India Limited, BSE Limited and NSDL.

Date: 8th November 2023 Place: Gurugram

Nestlé India Limited **Pramod Kumar Rai Company Secretary**

QUEST SOFTECH (INDIA) LIMITED

Cabin no 11, 7th Floor AndheriWorkflo, Times Square,next to sai service, Andheri East, Mumbal, Maharashtra 400069

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEP 30, 2023

Sr.			Ended				Enaea	
No.	Particulars			30-Sep-22			31-Mar-23	
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	
1	Income							
	(a) Revenue from Operations	1.92	0.30	-	2.22	-	2.61	
	(b) Other Income	0.51	0.51	-	1.02	-	3.86	
	(c) Total Income [(a) + (b)]	2.43	0.81		3.24		6.47	
2	Expenses:					-		
l	(a) Purchase Cost	184.31	1.86	-	186.17	-	2.10	
l	(b) Changes in Inventory	(182.73)	(1.60)	-	(184.33)	-	-	
	(c) Direct Expenses	0.01	0.01	-	0.02	-	-	
l	(d) Employee Benefits Expenses	29.56	30.62	1.34	60.18	2.61	8.47	
l	(e) Finance Costs	13.31	12.37	-	25.68	-	0.49	
l	(f) Depreciation and Amortisation Expenses	1.07	0.41	-	1.48	-	-	
	(g) Other Expenses	29.36	16.52	1.72	45.88	2.76	29.86	
	(f) Total Expenses [(a) to (e)]	74.89	60.19	3.06	135.08	5.37	40.92	
3	Profit before Exceptional Items							
	and Tax [1 (c) - 2 (f)]	(72.46)	(59.38)	(3.06)	(131.84)	(5.37)	(34.45)	
4	Exceptional Items							
5	Profit before Tax [3-4]	(72.46)	(59.38)	(3.06)	(131.84)	(5.37)	(34.45)	
6	Tax Expense:							
l	(a) Current Tax			-		-		
	(b) Deferred Tax	(0.81)	1.26	-	0.45	-	0.20	
_	(c) Earlier Year Tax Adjustments	-	(00.00)	(0.00)		-	1.00	
7	Profit after Tax [5 - 6]	(71.65)	(60.64)	(3.06)	(132.29)	(5.37)	(35.65)	
8	Other Comprehensive Income (net of tax)	-	-	-		-	-	
9	Total Comprehensive Income	(74.05)	(00.04)	(0.00)	(400.00)	(5.07)	(05.05)	
	for the period [7+8]	(71.65)	(60.64)	(3.06)	(132.29)	(5.37)	(35.65)	
10	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10 each)	1 000 00	1 000 00	1,000.00	1 000 00	1.000.00	1.000.00	
11		1,000.00	1,000.00	1,000.00	1,000.00	1,000.00	1,000.00	
l''	Revaluation Reserve)	_					(666.81)	
12		-	<u> </u>	-		-	(000.01)	
' -	(i) Basic	(0.72)	(0.61)	(0.03)	(1.32)	(0.05)	(0.36)	
l	(i) Diluted	(0.72)	(0.61)	(0.03)	(1.32)	(0.05)	(0.36)	
* Fa	urnings per equity share for the Quarter						(5.00)	
	es to the Financial Results:	una man	rour ende	Ju 415 110t	amadize	,		
	lotes to the Financial Results;							

The financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act 2013, read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended and other accounting principles The Statutory Auditors of the Company have conducted a limited review of the financial

results for the quarter ended and half year ended September 30, 2023 pursuant to the requirements of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirement (LODR) Regulations 2015. These financial results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their respective meetings held on November 07, 2023. The Company has ventured into business sales and services related to Electric vehicle chargers and charging statlons since March 2023. Company does not carry out operations in "Development of Software". All activities of the Company revolve around the main business. Hence, the disclosures required under the Indian Accounting

Standard 108 on Operating Segment are not applicable to the Company. The figures for the earlier periods have been regrouped / reclassified / restated wh

necessary to make them comparable with those of the current period.

For and on behalf of the Board of Directors

Vipul N. Chauhai aging Director DIN: 01241021

For Quest Softech (India) Limited

Place: Vadodara Date: November 07, 2023

For Advertising in

Contact JITENDRA PATIL Mobile No.: 9029012015

TENDER PAGES

Landline No.: 67440215

RISHABH ENTERPRISES LIMITED

CIN: L51909MH1984PLC217695 Regd. Office: Warden House, 340, J.J. Road, Byculla, Mumbai - 400 008.

TEL: (91) 22 2302 7900 | FAX: (91) 22 2307 7231

Website: www.rishabhenterprisesItd.com | Email: cosec@rishabhent EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH SEPTEMBER, 2023

(₹. in Lacs except EPS)						
Particulars	Quarter Ended 30/09/2023 (Unaudited)	Quarter Ended 30/09/2022 (Unaudited)	Year Ended 31/03/2023 (Audited)			
Total Income from operations (net)	1.86	1.97	7.72			
Net Profit/(Loss) for the period (before Tax,						
Exceptional and/or Extra ordinery items)	1.28	1.67	3.75			
Net Profit/(Loss) for the period before Tax						
(after Exceptional and/or Extra ordinery items)	1.28	1.67	3.75			
Net Profit/(Loss) for the period after Tax	1.00		0.40			
(after Exceptional and/or Extra ordinery items)	1.28	1.14	3.12			
Total Comprehensive Income for the period						
[Comprising Profit/(Loss) for the period (after Tax)and other Comprehensive						
Income (after tax)	4.14	11.51	25.91			
Equity Share Capital	100.00	100.00	100.00			
Reserves - Other Equity	100.00	100.00	100.00			
(excluding Revaluation Reserve as shown in						
the Audited Balance Sheet of previous year)	-	-	114.58			
Earning per share (before extraordinery items)						
(of Rs.10/-each)						
(a) Basic	0.12	0.12	0.31			
(b) Diluted	0.12	0.12	0.31			
* Not Annualised						

NOTES:

(a) The above is an extract of the detailed formate of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full formate of Quarterly Financial Results are available on the website of the stock exchange at www.msei.in and on the Company's website at www rishabhenterprisesItd.com (b) There is no change in accounting policies and hence there is no impact on Profit & Loss.

(c) No Exceptional or extra ordinery items adjusted.

Rishabh Enterprises Limited

Place : Mumbai Date: 07/11/2023

Director (DIN 00116132)

Shashi Kumar Dujari

(₹ In Crores)

Place: Ahmedabad

DCM

LIMITED

Date: November 08, 2023

Regd. Office: 2050-2052, 2nd Floor, Plaza-II, Central Square, 20, Manohar Lal Khurana Marg, Bara Hindu Rao, Delhi - 110006 E-mall: Investors@dcm.In Phone: 011-41539170 CIN: L74899DL1889PLC000004

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND SIX MONTH ENDED SEPTEMBER 30, 2023 [IN TERMS OF REGULATION 47 (1) (B) OF THE SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATION, 2015, AS AMENDED]

ш			Standalone				Consolidated						
Sr.		For the quarter ended SIx Months ended		hs ended	For the year ended	For the quarter ended		ended	Six Months ended		For the year ended		
	Particulars	September 30, 2023	June 30, 2023	September 30, 2022	September 30, 2023	September 30, 2022	March 31, 2023	September 30, 2023	June 30, 2023	September 30, 2022	September 30, 2023	September 30, 2022	March 31, 2023
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income from operations	74	139	-	213	-	6	1,782	1,787	1,771	3,569	3,559	6,945
2	Net Profit/(Loss) for the period (before tax)	(277)	(164)	499	(441)	159	(616)	(7)	(2)	737	(9)	722	489
3	Net Profit/(Loss) for the period after tax	(277)	(164)	499	(441)	159	(616)	(69)	(61)	671	(130)	599	233
4	Total Comprehensive Income/(Expense) for the period												
Ш	[Comprising Profit/(Loss) for the period after tax and												
Ш	Other Comprehensive Income/(Expense)]	(261)	(148)	518	(409)	197	(552)	(53)	(45)	691	(99)	638	302
5	Equity Share Capital	1,868	1,868	1,868	1,868	1,868	1,868	1,868	1,868	1,868	1,868	1,868	1,868
6	Other equity		-	-	-	-	(1,078)	_	-	-	-	-	(372)
7	Earnings/ (loss) per equity share (EPS) of Rs. 10 each												
	(not annualised)												
	Basic and diluted	(1.48)	(0.88)	2.67	(2.36)	0.85	(3.30)	(0.37)	(0.33)	3.59	(0.70)	3.21	1.25
_	+							•					

- The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meeting(s) held on November 08, 2023. The Limited Review Report of the Statutory Auditors has been filed with the BSE Limited and National Stock Exchange of India Limited.
- The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchanges (i.e. BSE Limited and National Stock Exchange of India Limited) under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended. The details in prescribed format of the results are available on the website of Stock Exchanges (www.bseindia.com and www.nseindia.com) and the Company's website www.dcm.in

For and on behalf of the Board For DCM Limited

Sd/-Jitendra Tuli **Managing Director** DIN: 00272930

CLASSIFIED CENTRES IN MUMBAI

Sanjeet Communication Fort. Phone: 40024682/40792205 S. Arts Advtg. Masjid Phone: 23415111

Place: Delhi

Date: 08.11.2023

Taj Publicity Services, Byculla (W), Phone: 2305 4894. Mobile: 9892011371. Yugarambha Advertising, Girgaon Phone : 2386 8065. Mobile : 9869074144

Aaryan Publicity Dadar (E), Phone: 022-65881876 Mobile: 9320111876 B. Y. Padhye Publicity Services Dadar (W), Phone: 2422 9241/ 2422 0445.

DATEY Advertising, Datey Bhavan, Dadar (W) Mobole : 8452846979/ 9930949817 Hook Advertainment Dadar Mobile : 8691800888

Central Advertising Agency Mahim (W), Phone : 24468656 / 24465555 Charudatta Advertising Mahim (W), Phone: 24221461 Jay Publicity, Dadar (E), Phone : 24124640

Pallavi Advtg. Dadar (W), Mobile: 9869109765 Shree Swami Samarth Advertising Dadar (W), Phone : 24440631 Mobile : 9869131962

Stylus Arts, Dadar (W), Phone : 24304897 машпда (w), Phone : 2446 6191

Achievers Media

Vijaya Agencies, Dadar (W), Phone : 2422 5672. Mobile : 9920640689 Media Junction, Matunga (W), Phone: 022-66393184/ 022-66332340 Mobile: 9820295353/ 9821656198

NEOGEN CHEMICALS LTD.

Particulars

NEOGEN CHEMICALS LIMITED

Regd. Office: Office No. 1002, 10th Floor, Dev Corpora Bldg, Opp. Cadbury Co, Pokhran Road No. 2, Khopat, Thane - 400601 CIN: L24200MH1989PLC050919; Tel No.: +91 22 2549 7300; Email: investor@neogenchem.com; Website: www.neogenchem.com

Statement of Standalone & Consolidated Unaudited Financial Results for the Quarter and Half year ended September 30, 2023

STANDALONE CONSOLIDATED For the Half year ended For the Quarter Ended For the For the Quarter Ended For the Half year ended For the Year Year Ended Ended 30 Sept 2023 30 June 2023 30 Sept 2022 30 Sept 2023 30 Sept 2022 30 Sept 2023 30 Sept 2022 30 Sept 2023 | 30 June 2023 | 30 Sept 2022 31 Mar 2023 31 Mar 2023 Audited Unaudited Audited Total Income (net) 170.11 171.96 148.62 342.07 297.48 690.81 163.60 166.67 148.54 330.27 297.34 690.63 Total Expenses 157,68 156.20 134.61 313,88 267.84 619,70 152.67 153.06 134.61 305.73 267.84 619.70 Ш Share of Profit 0.05 0.02 0.06 0.07 0.10 0.10 Profit/(loss) before taxes (I-II+III) 12.43 15.76 14.01 28.19 29.64 71.11 10.98 13.63 13.99 24.61 29.60 71.03 V Income Tax 1. Current Tax 1.62 3.40 1.67 5.02 5.38 12.76 1.62 3.40 1.67 5.02 5.38 12.76 2. Deferred Tax 1.67 0.94 2.45 2.61 3.25 8.30 1.44 0.48 2.45 1.92 3.25 8.30 Profit for the period (IV-V) 9.14 11.42 9.89 20.56 21.01 50.05 7.92 9.75 9.87 17.67 20.97 49.97 0.28 Total Other comprehensive (expense)/income (0.06)(0.12)0.08 0.07 0.15 0.07 0.07 0.14 0.28 (0.06)(0.12)net of tax VIII Total comprehensive income for the period (VI+VII) 20.89 9.21 11.49 9.83 20.70 50.33 8.00 9.82 9.81 17.82 20.85 50.25 Paid up equity Share Capital 24.94 24.94 24.94 24.94 24.94 24.94 24.94 24.94 24.94 24.94 24.94 24.94 (Face Value per share of ₹ 10 each 457.58 X Other Equity 457.67 Earning Per Equity Share 3.66 4.58 3.96 8.42 3.17 3.92 3.95 7.09 8.41 ΧI 8.24 20.07 20.03 Basic & Diluted (*Not Annualized

Place: Thane, India Date November 8, 2023

- The above unaudited financial results of the Company for the quarter and half year ended September 30, 2023 have been prepared in accordance with the IND AS, as prescribed under section 133 of the Companies Act, 2013 read with the Companies (Indian Accounting Standards) Rules, 2015 and were reviewed by the Statutory Auditor and recommended by the Audit Committee and was approved by the Board of Directors at their meeting held on November 08, 2023
- The Board of Directors at its meeting held on October 5, 2023, inter alia approved the issue and offer of 14,42,358 equity shares on preferential basis for cash consideration. Subsequently, the shareholders of the Company at its Extra Ordinary General meeting held on October 28, 2023 has approved issue and offer of 14,42,358 shares of face value of ₹ 10 each on a preferential basis at an issue price of ₹ 1754.07 per Equity Share (including a premium of ₹ 1744.07 per Equity Share) aggregating up to ₹2,52,99,96,897 (Rupees Two Hundred and Fifty Two Crore Ninety Nine Lakh Ninety Six Thousand Eight Hundred Ninety Seven only) to the identified investors. The allotment of the said equity shares of the Company on a preferential basis was done on November 1, 2023
- Previous period/year's figures have been regrouped/rearranged wherever necessary to make them comparable.
- The company is in the business of manufacturing of specialty chemicals and accordingly has one reportable business segment For more details on results, visit investor relations section of the Company's website at www.neogenchem.com and financial result under corporates section of Stock Exchange's website at www.nseindia.com and www.bseindia.com.
- For and on behalf of Board of Directors of

Neogen Chemicals Limited Dr. Harin Kanani Managing Director DIN: 05136947



ઓમકારા એસેટ્સ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ રિજસ્ટર્ડ ઓફિસ: ૯, એમ.પી.નગર, ૧લી શેરી, કો-ગુ નગર એક્સ્ટે., તિરુપુર - દ૪૧૬૦૭ કોર્પોરેટ ઓફિસ: કોહિનુર સ્ક્વેર, ૪૭મા માળે, ન.ચિ.કેળકર માર્ગ, રા.ગ.ગડકરી ચોંક, દાદર (પશ્ચિમ) મુંબઈ- ૪૦૦૦૨૮ ટેલિ: ૦૨૨-૨૬૫૪૪૦૦૦ મોળા: +૯૧૮૬૫૭૯૬૯૨૩૧/+૯૧૮૬૫૭૯૬૯૨૩૩

એપેન્ડિક્સ IV (સ્થાવર મિલકત માટે) (નિયમ ૮(૧))

આથી, ઇન્ડસઇન્ડ બેંક લિ.ના અધિકૃત અધિકારીએ તરીકે ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સેક્શન ૧૩(૧૨)ને સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો,૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાણે લેતા હેઠળ મળેલ અધિકારોની રૂએ ૨૧/૦૭/૨૦૨૦ ના રોજ ડિમાન્ડ નોટિસ મોકલીને મે. અંજલિ ટાયર્સ સેલ્સ એન્ડ સર્વિસીઝ(દેવાદાર), (૨) શ્રી નિખિલ પંજાબી (જામીનદાર/પ્રોપ્રાયટર) અને (૩) શ્રીમતી આરતીબેન ઘનશ્યામદાસ પંજાબી (જામીનદાર/ગિરવેદાર)ને નોટિસમાં આપેલ ૨કમ ૨૦/૦૭/૨૦૨૦ મુજબ રૂ. ૪૪,૩૩,૮૦૬.૯૭ (અંકે રૂપિયા ચુમ્માલીસ લાખ તેંત્રીસ હજાર આઠસો છ અને પૈસા સત્તાણું પૂરા) ઉપરાંત આ નોટિસમાં જણાવ્યા મુજબ સંબંધિત ક્રેડિટ સુવિધા સામે ઉલ્લેખ કર્યા મુજબ ૨૧/૦૭/૨૦૨૦થી થતા વ્યાજ તથા આગળના કોસ્ટ્સ, ચાર્જેસ અને થયેલ ખર્ચા વગેરે સાથે આ નોટિસ મળ્યાની તારીખથી દિન ૬૦માં ચૂકવી જવા જણાવેલ.

વધુમાં, ઓન રેકર્ડ અસલ લેણદાર ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડ(આઇબીએલ)એ ઉપરોક્ત દેવાદારો/ધિરાષ્ ખાતાના આખાય બાકી દેશા અંડરલાઇંગ સિક્યોરિટી સહિત પોતાના તમામ અધિકારો, ટાઇટલ અને હિતો સહિત ઓમકારા પીએસ ૩૦/૨૦૨૧-૨૨ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્યરત ઓમકારા એેસેટ્ર રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડને સરફૈસી કાયદાની જોગવાઈઓ હેઠળ એસાઇન કરેલ છે. ઓમકાર એેસેટ્સ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ (ઓએઆરપીએલ) તે કંપની ધારા, ૧૯૫૬ હેઠળ રચાયેલી અને રિઝર્વ બેંક ઓફ ઇંડિયા (આરબીઆઇ) સાથે ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (સરફૈસી કાયદો ૨૦૦૨) ના સેક્શન ૩ હેઠળ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની તરીકે રજિસ્ટર્ડ કંપની છે જેનો સીઆઇએન નં CIN U67100TZ2014PTC020363 છે જેની રજિસ્ટર્ડ ઓફિસ ૯, એમ.પી.નગર, ૧લી શેરી કોન્ગુ નગર એક્સ્ટે., તિરુપુર-૬૪૧૬૦૭, અને કોર્પોરેટ ઓફિસ : કોહિનૂર સ્ક્વેર, ૪૭મા માળે ન.ચિ.કેળકર માર્ગ, રા.ગ.ગડકરી ચૉક, દાદર (પશ્ચિમ) મુંબઈ- ૪૦૦૦૨૮ ખાતે છે જે અત્રે ઓમકાર પીએસ ૩૦/૨૦૨૧-૨૨ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.

સદર દેવા/નાણાંકીય સહાયના આ એસાઇનમેન્ટના અનુસંધાને ઓમકારા એેસેટ્સ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ (ઓએઆરપીએલ)એ ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડ(આઇબીએલ)ના પેંગડામાં પગ મૂક્યો છે તથા આખીય લેણી રકમ વસૂલ કરવા અને સિક્યોરિટી જપ્ત કરવા અધિકારી બની છે. મે. અંજલિ ટાયર્સ સેલ્સ એન્ડ સર્વિસીઝ(દેવાદાર), (૨) શ્રી નિખિલ પંજાબી (જામીનદાર/પ્રોપ્રાયટર) અને (૩) શ્રીમતી આરતીબેન ઘનશ્યામદાસ પંજાબી (જામીનદાર/ગિરવેદાર) સરફૈસી કાયદાના સેક્શન ૧૩(૨) મુજબ ૨૧/૦૭ ૨૦૨૦ની નોટિસ મુજબની ૨કમ ચૂકવવામાં નિષ્ફળ ગયેલ છે. ઓમકારા એસેટ્સ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના સરફૈસી કાયદાના સેક્શન ૧૩ ના સબ-સેક્શન(૧૨) પ્રમાણે નિયુક્ત અધિકૃત અધિકારીએ નીચે વર્ણન કરેલ સિક્યોર્ડ અસ્ક્યામતો /સ્થાવર /જંગમ મિલકતોનો સદરહુ કાયદાના સેક્શન ૧૩ન સબ-સેક્શન (૪) અને સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમો પૈકી નિયમ

સાથે વંચાણે લેતાં હેઠળ મળેલ અધિકારથી આ ૦૫મી નવેમ્બર, ૨૦૨૩ના રોજ કબજો લીધો છે. દેવાદાર/પ્રોપ્રાયટર/ ગિરવેદાર/જામીનદારને વિશેષરૂપે અને જાહેર જનતાને સામાન્ય રીતે આ મિલકત (તો, સાથે કોઈ વ્યવહાર ન કરવા માટે ચેતવણી આપવામાં આવે છે અને મિલકતો સાથે આવો કોઈ પણ વ્યવહાર તા.૨૦/૦૭/૨૦૨૦ મુજબ . ૪૪,૩૩,૮૦૬.૯૭ (અંકે રૂપિયા ચુમ્માલીસ લાખ તેંત્રીસ હજાર આઠસો છ અને પૈસા સત્તાણું પૂરા) ઉપરાંત આ નોટિસમાં જણાવ્યા મુજબ સંબંધિત ક્રેડિટ સુવિધા સામે ઉલ્લેખ કર્યા મુજબ ૨૧/૦૭/૨૦૨૦થી થતા વ્યાજ તથા આગળના કોસ્ટ્સ, ચાર્જેસ અને થયેલ ખર્ચા વગેરે સાથે ઓમકારા પીએસ ૩૦/૨૦૨૧-૨૨ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્યરત ઓમકારા એસેટ્સ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ જેની કોર્પોરેટ ઓફિસ કોહિનૂર સ્ક્વેર, ૪૭મા માળે, ન.ચિ.કેળકર માર્ગ, રા.ગ.ગડકરી યૉક, દાદર (પશ્ચિમ) મુંબઈ- ૪૦૦૦૨૮ ખાતે છે તેના ચાર્જને અધીન રહેશે.

સિક્યોર્ડ અસ્ક્યામત છોડાવવાના સંદર્ભે મળવાપાત્ર સમયમર્યાદા અંગે કાયદાના સેક્શન ૧૩ન ક્ષબસેક્શન (૮)નીજોગવાઈ તરફ દેવાદારનું ધ્યાન દોરવામાં આવે છે.

અમારી કંપની પાસે ઉપરના ખાતાની અને જેનો કબજો લીધો છે તે હાઇપોથેકેટ/એસાઇન/ચાર્જીગિરવે રાખેલ અસ્ક્યામતો/ મિલકતોની વિગતો નીચે મુજબ છેઃ

સ્થાવર મિલકતનું વર્ણનઃ

મોજે કસબા, આરટીઓ રોડ, વારસિયા વડોદરા ખાતે રજિસ્ટ્રેશન જિલ્લો વડોદરા પેટા જિલ્લો વડોદરા ખાતે આવેલ જમીન રે.સ.નં. ૮૧૭ ધારક, હિસ્સા નં. ૨/૧ પૈકી, પ્લોટ નં. ૨, સી.સ. નં. ૩૭૪૩ (એરિયા માપણી ૩૯૭.૯૮.૭૮ ચોરસ મીટર) સોનામહાલ નામની સ્કીમમાં બંધાયેલ સ્ટાઇલમાં બીજા માળે, ફ્લેટ નં. ૨૦૪ બિલ્ટ અપ એરિયા માપણી ૫૮.૫૩ ચોરસ મીટર. અવિભાજિત જમીન એરિયા ૪૮.૭૮ ચો.મી. તે શ્રીમતી આરતીબેન ઘનશ્યામદાસ પંજાબીના નામે આવેલ મિલકતના તમામ હક્કહિસ્સા. જેની સીમાઓ છેઃ પૂર્વેઃ મેઇન રોડ, પશ્ચિમેઃ સિંધુપાર્ક સોસાયટી, ઉત્તરે ઃફ્લેટ નં. ૨૦૦ અને ૨૦૬, દક્ષિણે ફ્લેટ નં. ૨૦૩.

તા. ૦૫.૧૧.૨૦૨૩ સ્થળઃ વડોદરા અધિકૃત અધિકારી વતી, ઓમકારા એસેટ્સ રિકન્સ્ટ્રક્શન પ્રા.લિ (ઓમકારા પીએસ ૩૦/૨૦૨૧-૨૨ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્યરત

ફોર્મ નં. આઈએનસી-૨૫અ (કંપની ધારા (ઈનકોર્પોરેશન) ૨૦૧૪ની કલમ ૪૧ મુજબ) કેન્દ્ર સરકાર પ્રાદેશિક અધિકારી

ઉત્તર પશ્ચિમ પ્રદેશ, અમદાવાદ સમક્ષ આરઓસી ભવન, રૂપલ પાર્ક સોસાયટી સામે, અંકુર બસ સ્ટેન્ડ પાછળ, નારણપુરા, अमहावाह उट००१ उ

કંપની ધારા ૨૦૧૩ની કલમ ૧૪ કંપની એક્ટ, ૨૦૧૩ અને કલમ ૪૧ કંપની એક્ટ, (ઈનકોર્પોરેશન) ૨૦૧૪ની બાબતમાં

સ્પાન કિનકેપ લિમિટેડ જેની રજિસ્ટર્ડ ઓફિસ - એ-૭૦૩, સપથ - ૪, કર્ણાવતી ક્લબની સામે, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૧ પની બાબતમાં

સામાન્ય જનતાને નોટીસ આપવામાં આવે છે કે અરજદાર કંપની કેન્દ્ર સરકારને કંપની એક્ટ,૨૦૧૩ની કલમ૧૪ મુજબ પ્રસ્તાવ કરે છે કે કંપની તેમને "**લિમિટેડ**" માંથી "પ્રા**ઇવેટ લિમિટેડ**" માં રૂપાંતરણ માંગે છે. આ માટે કંપની નામે મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં ફેરફાર કરવા અને મંજૂરી મેળવવા માટે તા. ૦૮ નવેમ્બર, ૨૦૨૩ન રોજ મળેલી ખાસ સાધારણ સભામાં ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

જો કોઈ વ્યક્તિને આ કંપની ના ૩પાંતરણ થી અસર થતી હોય તો તેને પોતાની અસરના કારણો સોગંદનામા પર તેણે અને તેણીએ, **રીજીયોનલ ક્રિરેક્ટર, નોર્થ વેસ્ટર્ન રીજીયન**, આરઓસી ભવન, રૂપલ પાર્ક સોસાયટી સામે, અંકુર બસ સ્ટેન્ડ પાછળ, નારણપુરા અમદાવાદ૩૮૦૦૧૩ ને આ અરજી પ્રસિદ્ધ થયાના ચૌદ દિવસની અંદર આપવાની રહેશે અને તે કોપી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસના નીચે આપેલ સરનામા ખાતે આપવાની રહેશે. રપાન ફિનકેપ લિમિટેડ,

એ-૭૦૩, સપથ - ૪, કર્જ્ઞાવતી ક્લબની સામે, એસ. જી. હાઈવે, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૧૫

सदी/- अभिमन्यु डमवेश त्रिपाठी (डिरेड्टर)

તારીખઃ ૦૯-૧૧-૨૦૨૩ खाः अभहावाह

(ડીન: ૦૬૯७૮૧૯૨) એ-७०३, સપથ - ૪, કર્ણાવતી ક્લબની સામે, એસ.જી. હાઈવે, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૧૫

स्पान क्लिकेप समिटेड. वती,

પેગાસસ એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ -પદ, પમે માળે, ફ્રી પ્રેસ હાઉસ, નરીમાન પોઇંટ, મુંબઈ-૪૦૦ ૨૧, ફોનઃ ૯૧-૨૨૬૧૮૮૪૭૦૦

કબજા નોટિસ

(નિયમ ૮(૧))(સ્થાવર સંપત્તિ માટે)

આથી, આરબીએલ બેંક લિમિટેડના અધિકૃત અધિકારીએ ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (સરફ્રૈસી કાયદો), સેક્શન ૧૩(૧૨)ને ધી સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફ્રોર્સમેન્ટ) નિયમો,૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાણે લેતા હેઠળ મળેલ અધિકારોની રૂએ તા. ૩૦/૦૪ ૨૦૨૧ના રોજ ડિમાન્ડ નોટિસ મોકલીને દેણદાર/ સહ-દેણદાર/જામીનદાર અંબિકા એન્ટરપ્રાઇઝ હેમંત રોહિતભાઈ પરીખ અને હીનાબેન હેમંત પરીખને નોટિસમાં જણાવેલ રકમ ૩૦/૦૪/ ૨૦૨૧ મુજબ રૂ. ૬૮,૫૭,૭૦૩.૨૫/- (અંકે રૂપિયા અડસઠ લાખ સત્તાવન હજાર સાતસો ત્રણ અને પૈસા પચ્ચીસ પૂરા) ૦૧/૦૫/૨૦૨ ૧થી કરારે આધારિત દરે થયેલા અને વસૂલાતની તારીખ સુધી થનાર વ્યાજ અને અન્ય ચાર્જેસ, કોસ્ટ્સ અને ખર્ચાઓ સહિત આ નોટિસ મળ્યાની તારીખથી દિન ૬૦માં ભરપાઈ કરી જવા કહેલ.

સદર દેવાદાર/સહ-દેવાદાર/જામીનદારની દેણી ૨કમ તેના સિક્યોરિટી હિતોસહિત પેગાસસ એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રા.લિ. તેની પેગાસસ ગૃપ થર્ટીનાઇન ટ્રસ્ટ-૨ (પેગાસસ)ના ટ્રસ્ટી તરીકેની ક્ષમતામાં કાર્યરત છે તેની તરફેણમાં તા. 30/૦૯/૨૦૨૧ના એસાઇન્મેન્ટ એગ્રીમેન્ટ મુજબ અને સરફૈસી કાયદાની જોગવાઈ હેઠળ એસાઇન કરવામાં આવેલ છે.

સદર દેવાદાર/ સહ-દેવાદાર/જામીનદાર આ ૨કમ ચુકવવામાં નિષ્ફળ જવાને લીધે, સરફ્રૈસી કાયદાના સેક્શન ૧૪ હેઠળ નામદાર ૪થા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અમદાવાદ(ગ્રામ્ય) સમક્ષ અરજી ફાઇલ કરવામાં આવી છે. વધુમાં તા. ૧૦/૦૮/૨૦૨૩ના આદેશથી નામદાર ૪થા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, અમદાવાદ(ગ્રામ્ય) દ્વારા શ્રી એ.એ. પતાણી, આસિસ્ટન્ટ ચીફ કોર્ટને કૉર્ટ કમિશનર તરીકે કામ કરવા અને નીચે જણાવેલ અસ્ક્યામતોનો ૦૫/૧૧/૨૦૨૩ના રોજ ફિઝિકલ કબજો લેવા અને તેને પેગાસસ એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રા. લિ.ના અધિકૃત અધિકારીને સોંપવા દિશાનિર્દેશ કરેલ.

સદર દેવાદાર/ સહ-દેવાદાર/જામીનદાર આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જવાને લીધે, અત્રે દેણદારને તથા જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે અધિકૃત અધિકારીએ સદરહુ કાયદાના સેક્શન ૧૩ના સબ-સેક્શન (૪)ને સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એન્ફ્રોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ પૈકી નિયમ ૮ સાથે વંચાણે લેતાં હેઠળ મળેલ અધિકારથી નીચે વર્ણનકરેલ મિલકતનો કબજો ૦૫/૧૧/૨૦૨૩ના રોજ લીધો છે. સદર દેવાદાર/ સહ-દેવાદાર/જામીનદારને વિશેષ રૂપે અને જાહેર જનતાને સામાન્ય રીતે આ મિલકત સાથે કોઈ વ્યવહાર ન કરવા માટે ચેતવણી આપવામાં આવે છે અને કોઈ પણ આવો વ્યવહાર ૩૦/૦૪/૨૦૨૧ મુજબ રૂ. ૬૮,૫૭,૭૦૩.૨૫/- (અંકે રૂપિયા અડસઠ લાખ સત્તાવન હજાર સાતસો ત્રણ અને પૈસા પચ્ચીસ પૂરા) ૦૧/૦૫/૨૦૨૧થી કરાર આધારિત દરે થયેલા અને વસૂલાતની તારીખ સુધી થનાર વ્યાજ અને અન્ય ચાર્જેસ, કોસ્ટ્સ અને ખર્ચાઓ સહિતની ૨કમને પેગાસસના ચાર્જને અધીન રહેશે.

સિક્યોર્ડ અસ્ક્યામત છોડાવવાના સંદર્ભે મળવાપાત્ર સમયમર્યાદા અંગે કાયદાના સેક્શન ૧૩ન સબસેક્શન(૮)નીજોગવાઈ તરફ દેવાદારનું ધ્યાન દોરવામાં આવે છે .

સ્થાવર મિલકતનું વર્ણન

મોજે વેજલપુર, પેટાજિલ્લો અમદાવાદ-૧૦(વેજલપુર) અને રજિસ્ટ્રેશન જિલ્લો અમદાવાદ ખાતે સર્વે નં. ૪૦ પૈકી અને ૧૦૬/૨ પૈકી અને ૮૬ પૈકી સાથે, ટી.પી. સ્કીમ નં. ૩, એફ.પી. નં ૨૯૩/૨, ૨૯૩/૩ પૈકી સબ પ્લોટ નં. ૧ પર બંધાયેલ સ્ક્રિમ નામે સચીન ટાવર, ગેરતપુર ભાગ્યલક્ષ્મી કો-ઓપ હાઉસિંગ સોસાયટી લિમિટેડ વિભાગ-૮માં રહેણાંક મિલકત ક્લેટનં. ઈ ૯૨, ૯મે માળે, ઈ બ્લોકમાં માપણી ૧૩૩.૭૬ ચો.મી. બિલ્ટઅપ એરિયા..સીમાઓ નીચે મુજબ છેઃ પૂર્વતરફઃ ફ્લેટનં. ઈ-૯૧, દક્ષિણ તરફઃ કોમન પેસેજ અને ફ્લેટનં. ઈ-૯૩, પશ્ચિમ તરફઃ સોસાયટી કોમન રોડ અને બગીચો, ઉત્તર તરફઃ સોસાયટી કોમન રોડ.

તા. ૦૫.૧૧.૨૦૨૩

અધિકૃત અધિકારી, પેગાસસ એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ તેની પેગાસસ ગૃપ થર્ટી નાઇન ટ્રસ્ટ-૨ ના ટ્રસ્ટી તરીકેની ક્ષમતામાં કાર્યરત

શેરબજારનો કેઝ ઘટયો! ૭૫ ટકા રોકાણકારો નિષ્ક્રીય

દેશમાં શેરબજારમાં સતત તેજીના પગલે ખુદ્ધી રહેલા ડીમેટ ખાતાની ઝડપ હવે ધીમી પડી છે અને સેબી દ્વારા લાંબા સમયથી નિષ્ક્રીય રહેલા ડીમેટ ખાતામાં જે ખાતાઓ સતત બાર માસથી નિષ્ક્રીય હોય તેને ઈનઓપરેટીવ શ્રેણીમાં મૂકવા આદેશ આપ્યો છે. સેબી દ્વારા તમામ શેરબ્રોકર કે જે તેના ગ્રાહકોના ડીમેટ એકાઉન્ટ સંભાળે છે તેને આ પ્રકારની સૂચના આપી છે. અગાઉ છ મહિના સુધી જે ખાતાઓ નિષ્ક્રીય રહ્યા હતા તેને ઈનઓપરેટીવ તરીકે જાહેર કરાયા હતા. હવે તે અવધી વધારીને ૧૨ માસની કરવામાં આવી છે. સેબીના રિપોર્ટ મુજબ દેશમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે પરંતુ એકટીવ એકાઉન્ટની સંખ્યા સતત ઘટી રહી છે અને ૭૫ ટકા ખાતાઓ નિષ્ક્રીય હોવાનું બહાર આવ્યું છે.

□ HDFC BANK |

એચડીએફ્સી બેન્ક લિમિટેડ

એચડીએફ્સી હાઉસ, મીઠાખળી છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ. ફોન : (૦૯૯) ૬૬૩૦७૦૦૦ એથકીએફસી બેન્ક લિમિટેકના (ભૂતકાળમાં **એથકીએફસી લિ.**, જેનું નામદાર એનસીએલટી-મુંબઈ ના તારીખ ૧૭ માર્ચ, ૨૦૨૩ના આદેશ મુજબ મંજુર થયેલ એકીકરણ યોજના અનુસાર **એથકીએફસી બેન્ક લિમિટેક** સાથે એકીકરણ થયેલ છે) અધિકૃત અધિકારીઓને સિક્યોરિટાઈઝેશન એન્ર રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાત્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ કલય ૧૩(૧૨), સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના રૂલ 3 સાથે વાંચતા મળેલ સત્તાને આધિન રહી ઉપરોક્ત એક્ટની કલય ૧૩(૨) હેઠળ નીચેના બોરોઅટ(કાયદેસરના વારસ(સો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)ને ડિમાન્ડ નોટિસ પાઠવવામાં આવેલ, જે અનુસાર તેમના જે તે નામ સામે દર્શાવેલ ૨કમ સહિત નોટિસમાં દર્શાવાયલે તે ૨કમ ઉપરનું વ્યાજ, નોટિસ તારીખથી ૯૦ દિવસમાં ચૂકવી આપવા જણાવાયેલ છે. જે મુજબ પ્રાસંગિક ખર્ચા, અન્ય ખર્ચા, ચાર્જિસ વગેરે ચૂકની અને અથવા જાયા થાય તો સીના આપવાના હતો

જમાવ	ાવ ત્યા સુષાના આપવાના રહશ.				
અનુ. નં.	બોરોઅર/કાયદેસરનાં વારસદાર(રો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)નાં નામ	તારીખના રોજ બાકી લેજ્ઞાં* રૂ.	ડિમાન્ડ નોટિસ તારીખ	પઝેશન તારીખ ફીઝિકલ/ સિમ્બોલીક	સ્થાવર મિલકત(તો) / સલામત અસ્કયામત(તો) નું વર્જ઼ન
(એ)	(બી)	(સી)	(13)	(8)	(એફ)
q	શ્રી જિગ્નેશકુમાર જી. પટેલ (બોરોઅર) શ્રીમતી પીનલબેન જિગ્નેશકુમાર પટેલ (કો-બોરોઅર)	રૂા. ૨૫,૦૯,૯૮૫/- ૩૦ જૂળ, ૨૦૨૩ ના રોજ*	૦૧ ઓગ., ૨૦૨૩	૨૦૨૩ સિમ્બોલીક	ક્લેટ-એચ-૩૦૪, ત્રીજો માળ, હોમ ટાઉન, રે. સ. નં. ૧૬૫, દીપી નં૬૬, એફપી નં૯૧, આકાશ એપાર્ટમેન્ટ પાસે, જીએસટી ક્રોસીંગ, ન્યુ રાણીપ, રાણીપ, અમદાવાદ-૩૮૨૪૮૦.

લાગુ પડતા વધારાના વ્યાજ સાથે, પ્રાસંગિક ખર્ચા, અન્ય ખર્ચા, ચાર્જિસ વગેરે ચૂકવજ્ઞી/જમા થાય ત્યાં સુધીના ગજ્ઞાશે.

જો કે, અહીં ઉપર દર્શાવેલ બોરોઅર/કાયદેસરના વારસદાર(રો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ) બાકી લેણી નીકળતી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયેલ છે. તેથી આ સાથે ઉપરોક્ત બોરોઅર/કાયદેસરના વારસદાર(રો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)ને વ્યક્તિગત રીતે અને જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે, **એથડીએફસી બેન્ક લિમિટેક**ના અધિકૃત અધિકારી/ઓ (ભૂતકાળમાં **એથડીએફસી લિ.**, જેનું નામદાર એનસીએલટી-મુંબઈ ના તારીખ ૧૭ માર્ચ, ૨૦૨૩ના આદેશ મુજબ મંજુર થયેલ એકીકરણ્ન યોજના અનુસાર **એથડીએફસી બેન્ક લિમિટેક** સાથે એકીકરણ થયેલ છે) દ્વારા ઉપરોક્ત એક્ટની કલમ ૧૩ (૪) હેઠળ અને ઉપરોક્ત નિયમના નિયમ ૮ સાથે વાંચતા મળેલ સત્તાને આધિન રહી, ઉપરોક્ત તારીખોએ અહીં ઉપર દર્શાવેલ સ્થાયી પ્રોપર્ટી(સિક્યોર્ડ એસેટનો oo મેળવી લેવામાં આવેલ છે.

અહીં ઉપરોક્ત બોરોઅર/કાયદેસર વારસો અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)ને વ્યક્તિગત રીતે અને જાહેર જનતાને આ સાથે સાવધાન કરવામાં આવે છે કે પરોક્ત સ્થાયી પ્રોપર્ટી/સિક્યોર્ડ એસેટ સાથેનો કોઈ સોદો કરાશે તો તે **એચકીએફસી બેન્ક લિમિટેક**ના ગિરો હક્કને આધિન રહેશે. બોરોઅર(સ) / કાયદેસરના વારસ (દારો) / કાયદેસરના પ્રતિનિધિ(ઓ)નું ધ્યાન દોરવામાં આવે છે કે એક્ટની કલમ-૧૩ ની પેટા કલમ (૮) ની

ક્ષેગવાઈઓ અનુસાર સમય રહેતાં પોતાની સલામત અસ્કયમાત/તો છોડાવી લે. કરવામાં આવેલ પંચનામું અને તૈયાર કરાયેલ ઈન્વેન્ટરી નીચે સહી કરનાર પાસે ઉપલબ્ધ છે; અને ઉપરોક્ત બોરોઅર(સ) / કાયદેસરના વારસદાર(રો)

ાયદેસરના પ્રતિનિધિ(ઓ)ને વિનંતી છે કે જે તે નકલ નીચે સહી કરનાર પાસેથી કામકાજના દિવસોએ કામકાજના સમય દરમિયાન મેળવી લે. વતી, એચડીએફસી બેન્ક લિ

CIN: L65920MH1994PLC080618, Website: www.hdfcbank.com

તારીખ : ૦૮-૧૧-૨૦૨૩ અદ્યર્કૃત અદ્યરાસી अशाउमाङ : १०१९ રજિ. ઓફિસ : એ ડીએફ્સી બેન્ક લિ., એચડીએફ્સી બેન્ક હાઉસ, સેનાપતી બાપટ માર્ગ, લોઅર પરેલ (પશ્ચિમ), મુંબઇ-૪૦૦૦૧૩.

SAYAJI INDUSTRIES LIMITED **SAYPJI**

P.O. Kathwada, Maize Products, Ahmedabad-382430 Website: www.sayajigroup.in • CIN: L99999GJ1941PLC000471

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND SIX MONTHS ENDED 30TH SEPTEMBER, 2023

Particulars	Quarter ended 30-09-2023 (Unaudited)	Six months ended 30-09-2023 (Unaudited)	Quarter ended 30-09-2022 (Unaudited)
Total income	22072.98	46644.44	25213.20
Profit /(Loss) before share in joint venture and tax	(495.41)	(727.87)	(641.05)
Profit in share of joint venture	149.85	228.18	39.45
Profit /(Loss) before tax	(345.56)	(499.69)	(601.60)
Profit /(Loss) after tax	(115.73)	(191.75)	(374.05)
Total Comprehensive income/(loss) for the period	(153.42)	(242.45)	(466.36)
Paid-up equity share capital (face value of Rs. 5/- per share)	316.00	316.00	316.00
Other equity excluding revaluation reserves as at March 31, 2023.	-	-	
Earning per equity share (in Rs.) (no annualized) (a) Basic (in Rs.) (b) Diluted (in Rs.)	(1.86) (1.86)	(3.08) (3.08)	(5.80) (5.80)
Notes: Extract of statement of standalone financial results:		(Rs	s. in Lakhs)

lotes: Extract of statement of standalone financial	(Rs. in Lakhs		
Particulars	Quarter	Six months	Quarter
	ended	ended	ended
	30-09-2023	30-09-2023	30-09-2022
	(Unaudited)	(Unaudited)	(Unaudited)
Total Income Profit /(Loss) before tax Profit /(Loss) after tax Total comprehensive income/(loss) for the period	21401.89	44726.30	24808.99
	(487.98)	(726.94)	(608.14)
	(256.12)	(414.93)	(391.83)
	(292.86)	(464.68)	(482.01)

1. The results have been reviewed by the Audit Committee of the Board and approved by the Board of Directors of the Company at its meeting held on November 07, 2023. The statutory auditors have conducted limited review of these results and have issued an unmodified opinion on the same.

2. Figures for the quarter ended 30th September, 2023 are balancing figures between the unaudited figures for six months ended 30th September, 2023 and the reviewd year-to-date figures up to the quarter ended 30th June, 2023.

The above is an extract of the detailed format of unaudited financial results for the quarter ended 30th September, 2023 filed with the BSE Ltd. Under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same, along with notes are available on www.bseindia.com and on company's website www.sayajigroup.in. The figures for the previous period have been regrouped/rearranged to make the same comparable

with current period figures. For and on behalf of Board of Directors

Place : Ahmedabad, Gujarat. Date: November 07, 2023

Vishal Priyam Mehta **Executive Director** DIN: 02690946

SAYPJI

સચાજી ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ

CIN: L99999GJ1941PLC000471 રજી. ઓફીસ : મેઇઝ પ્રોડક્ટ્સ, ચીનુભાઇ નગર, પી.ઓ. કઠવાડા, અમદાવાદ-382430 ફોન : +91 79 22901581 - 85 E-Mail: maize@sayajigroup.in - Website: www.sayajigroup.ln

પોસ્ટલ બેલેટ અને રિમોટ ઇ-વોટિંગ માટેની સૂચના

કંપનીના સભ્યોને આથી જાણ કરવામાં આવે છે કે, કંપની કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ ૧૦૮ અને ૧૧૦ અને કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમીનીસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ના નિયમ-૨૦ અને ૨૨ અનુસાર ૮મી એપ્રિલ, ૨૦૨૦ના રોજ સામાન્ય પરિપત્ર નંબર ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ ૨૦૨૦, ૨૨/૨૦૨૦ તા. ૧૫મી જૂન ૨૦૨૦, ૩૩/૨૦૨૦ તારીખ ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૦, ૩૯/૨૦૨૦ તા. ૩૧મી ડીસેમ્બર ૨૦૨૦, ૧૦/૨૦૨૧ તા. ૨૦/ ૨૦૨૧ તા. ૨૦/૨૦૨૧ તારીખ મી ડીસેમ્બર ૨૦૨૧, ૩/૨૦૨૨ તા. ૫મી મે, ૨૦૨૨, ૧૧/૨૦૨૨ તા. ૨૮મી ડીસેમ્બર ૨૦૨૨ અને ૦૯/૨૦૨૩ તા. ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (સામુહિક રીતે "એમસીએ પરિપત્રો") કોર્પોરેટ બાબતોના મૃત્રાલય દ્વારા જારી કરવામાં આવે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ અને ડિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (Listing Regulations) ના નિયમ-૪૪ અને અન્ય લાગુ કાયદાઓ, નિયમો એન વિનિયમો (કોઇપણ વૈદ્યાનિક ફેરફાર અને સમયાંતરે સુધારેલા સુધારા સહિત) અનુસાર કંપની દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમથી (રિમોટ ઇ-વોટિંગ) પોસ્ટ બેલેટ મતદાન દ્વારા શ્રી જયશીલ પરંજય હજરત (ડીઆઇએન-૦૮૨૩૪૧૩૬)ને સતત પાંચ વર્ષની બીજી મુદ્દત માટે કંપનીના બિન-કાર્યકારી સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પુનઃ નિયુક્ત કરવા અને કંપનીનું સંપૂર્ણ અથવા નોંધ પાત્ર ઉપક્રમ જેવું કે કંપનીની ગામ કઠવાડા, તા. દસક્રોઇ, જિલ્લો અમદાવાદમાં આવેલી કંપનીની સંપૂર્ણ જેમીનમાથી થોડો ભાગ અને ગામ સઇજ તા. કલોલ, જી. ગાંધીગનગર ખાતેની સંપૂર્ણ જમીનનું વેચાણ અથવા ભાડાપટ્ટો અથવા નિકાલ કરવા માટે કંપનીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સને અધિકૃત કરવા માટે સભ્યોની મંજુરી મેળવવા માટેની કાર્યવાહી કરી રહી છે.

તા. ૮-૧૧-૨૦૨૩ બુધવારના રોજ, કંપની દ્વારા પોસ્ટ બેલેટ નોટિસ, ખુલાસાત્મક નિવેદન અને ઇ-વોટિંગ સૂચના ફકત તે જ શેરધારકોને મોકલવામાં આવી છે, જેમના નામ સભાસદ અથવા લાભાર્થી માલિક તરીકે કંપનીના સભાસદ રજીસ્ટરમાં નોંધાયેલા છે, જે કંપનીના શેર ટ્રાન્સફર એજન્ટ તથા ડીપાઝીટરી દ્વારા જાળવવામાં આવેલ છે, તેમાં શકવાર તા. ૩-૧૧-૨૦૨૩ (કટ ઓફ ડેટ)ના રોજ નોંધાયેલ છે. સભ્યોના મતદાન અધિકારો કટ ઓફ ડેટ મુજબ કંપનીની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીમાં તેમના દ્વારા ધારણ કરવામાં આવેલા શેરના પ્રમાણસર ગણવામાં આવશે. કોઇપણ વ્યક્તિ કે જે કટ ઓફ ડેટ પર સભ્ય નથી તે માત્ર માહિતીના હેતુ માટે જ આ નોટિસનો ઉપયોગ કરે. નોટિસ કંપનીની વેબસાઇટ www.sayajigroup.in પર, BSE Limited ની વેબસાઇટ : www.bseindia.com પર અને કંપનીના શેરટ્રાન્સફર એજન્ટની વેબસાઇટ : https://emeetings.kfintech.com/ પર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

કંપનીએ રિમોટ ઇ-વોટિંગ સુવિધા પુરી પાડવા માટે Kfintech Technologies Limited ("KFin") ની સેવાઓ લીધી છે. રિમોટ ઇ-વોટિંગ શુક્રવાર તા. ૧૦-૧૧-૨૦૨૩ સવારે ૯-૦૦ (IST) વાગ્યાથી શરૂ થશે અને શનિવાર તા. ૯-૧૨-૨૦૨૩ ના રોજ સાંજે ૫-૦૦ (IST) વાગ્યે સમાપ્ત થશે. શનિવાર તા. ૯-૧૨-૨૦૨૩ના રોજ સાંજે ૫-૦૦ વાગે ઇ-વોટિંગ મોડ્યુલ-કે KFin દ્વારા અક્ષમ કરવામાં આવશે અને ત્યારબાદ સભ્યોને મતદાન કરવાની મંજૂરી આપવામાં

ભૌતિક શેરધારકોએ તેમનું ઇમેલ એડ્રેસ KFin અને ડિપોઝિટરીમાં રજીસ્ટર કરાવ્યું નથી તેઓ કંપનીના ઇ-મેલ આઇ.ડી. maize@sayajigroup.in અથવા કંપનીના RTA ના ઇ-મેઇલ આઇડી. evoting@kfintech.com પર કંપનીને જરૂરી વિગતો પ્રદાન કરી શકે છે. ડીમેટ શેરધારકો તેમનું ઇમેઇલ આઇ.ડી. અને મોબાઇલ નંબર તેમના સંબંધિત ડિપોઝિટરી પાર્ટીસીપન્ટ (DP) પાસે અપડેટ કરાવી લેવા. જો તમને Kfinની ઇ-વોટિંગ સિસ્ટર્મમાંથી રિમોટ ઇ-વોટિંગ સંબંધિત કોઇ પ્રશ્નો અથવા સમસ્યા હોય તો તમે Kfinને

તેના ઇમેઇલ આઇ.ડી. evoting@kfintech.com અથવા તેના ટોલ ફ્રી નંબર 1800 309 4001 ઉપર સંપર્ક કરી શકો છો. ઇલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન કરવાની સુવિધા સાથે જોડોયલી તમામ ફરિયાદો માટે શ્રી ભાસ્કર રોય, આસીસ્ટન્ટ

વાઇસ પ્રેસિડેન્ટ KFin Technologies Limited, Unit: Sayaji Industries Limited, Selenium Tower B, Plot 31-32, Gachibowli Financial District, Nanakramguda, Hyderabad-500032 અથવા તેમનો ઇમેઇલ આઇડી einwards.ris@kfintech.com અથવા ટોલ ફ્રી નં. 1800 309 4001 ઉપર સંપર્ક કરી શકે છે.

પોસ્ટલ બેલેટના પરિણામો સોમવાર તા. ૧૧-૧૨-૨૦૨૩ના રોજ અથવા તે પહેલા જાહેર કરવામાં આવશે અને કંપનીની વેબસાઇટ તેમજ Kfinની વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવશે અને તેની જાણ BSE લિમિટેડને કરવામાં ફોર, સચાજી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સહી/-

તારીખ : ૦૯-૧૧-૨૦૨૩ स्थण : अमहावाह

રાજેશ એસ. શાહ કંપની સેકેટરી અને કમ્પલાયન્સ ઓફિસર



BHAGWATI AUTOCAST LIMITED

BHAGWATI (CIN: L27100GJ1981PLC004718) Regd. Office: Survey No. 816 (New Survey No.259), Village: Rajoda, Near Bavla, Dist.: Ahmedabad 382 220 Phone: +91 2714 232283 / 232983 / 232066, email: cs@bhagwati.com

Statement of Unaudited Financial Results for the Quarter and Half year ended 30th September 2023

	Hs. In lakins except EPS								
Sr.		Quarte	r Ended	Half Year Ended	Year Ended				
No.	Particulars	30.09.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2023 (Unaudited)	31.03.2023 (Audited)				
1	Total Income from operations	3962.27	4203.17	7764.36	15442.09				
2	Net Profit for the period (before tax and exceptional items)	339.51	290.04	622.86	1083.10				
3	Net Profit for the period before tax (after exceptional items)	339.51	290.04	622.86	1083.10				
4	Net Profit for the period after tax (after exceptional items)	80.11	199.86	284.63	772.09				
5	Total comprehensive income for the period [comprising profit for								
	the period (after tax) and other comprehensive income (after tax)]	79.71	199.42	283.83	770.50				
6	Equity share capital (Face value per share Rs. 10/- each)	288.07	288.07	288.07	288.07				
7	Reserves excluding revaluation reserves	22000000000	XCXXXXXXXX		3154.21				
8	Earnings per share (before and after extraordinary items)				1000.000.000				
	(of Rs. 10/- each) Basic & Diluted	2.78	6.93	9.88	26.80				

101 The above financial results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors of the Company in their respective meetings held on November 08, 2023. The statutory Auditors of the company have carried out review of aforesaid results as per Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015.
[2] The financial results for the quarter and half year ended September 30, 2023 have been prepared in accordance with the Companies (Indian

Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.

[3] The above is an extract of the detailed format of Financial Results for the Quarter and half year ended 30th September, 2023, filed with the Stock Exchanges, under the Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results is available on the Stock Exchange website www.bseindia.com and on the Company's website By Order of the Board of Directors

For, Bhagwati Autocast Limited

(Dr. P. N. Bhagwati)

Chairman DIN: 00096799



Place: Ahmedabad Date: 08.11.2023

GUJARAT TERCE LABORATORIES LIMITED Reg. Office:- 122/2, Ravi Estate, Bileshwarpura, Chhatral, Dist. Gandhinagar (Gujarat)

Phone:- 079 - 41005079, CIN NO: L24100GJ985PLC007753 email: ho@gujaratterce.com website:www.gujaratterce.in

Extract of Unaudited Standalone Financial Results for the Quarter and Half Year Ended on September 30, 2023 RS.IN LAKHS] Half year ended Half year ended Year ended 30.09.2023 30.09.2022 31.03.2023 **Particulars** No Unaudited Unaudited Audited Income a) Revenue from operations (Net) 2,274.74 2,198.92 4,678.25 b) Other income 16.88 35.45 15.97 Net Profit / (Loss) for the period (before Tax, -97.28 -247.22 -289.39 Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items) -97.28 -247.22 -167.16 Net Profit / (Loss) for the period after Tax -247.22 (after Exceptional and/or Extraordinary items) -97.28 -167.16 Total Comprehensive Income for the period [Comprising Profit /(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] -97.28 -247.22 -167.16Paid up Equity Share Capital 742.03 742.03 742.03 Reserves (excluding Revaluation Reserve) -153.04 -135.82-55.76 Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) 1. Basic 2. Diluted -1.31 -3.33-2.25

(Rs. In Lakhs)

The above unaudited financial results have been reviewed by Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on 08.11.2023. The Statutory Auditors have carried out limited review of the financial results for the quarter and half year ended on 30th September, 2023.

The Above unaudited results have been prepared and presented as per Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended ("Ind AS") prescribed under section 133 of the Companies Act, 2013 and in terms of Regulations 33 of the SEBI (Listing Obligations and Disclosure Requitements) Regulations, 2015 (the "Listing Regulations"), and amendements made thereunder.

The above is an extract of the detailed format of Financial Results for the quarter ended on September 30, 2023 filed with the Stock exchanges as per SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015. The full format of financial results are available on the website of BSE at www.bseindia.com and on company's website www.gujaratterce.in

Place: Ahmedabad Date: 08.11.2023

By and order of the Board of Director For Gujarat Terce Laboratories Limited

> Aalap Prajapati (Managing Director and CEO) DIN: 08088327



Future Full of Colours (CIN - L24231GJ1998PLC034094)

Regd. Office: 7th Floor, Hasubhai Chambers, Opp. Town Hall, Ellisbridge, Ahmedabad- 380006, Phone No. (O) 079-26574371/72/73, (F) 079-26574374, Email: info@kiriindustries.com website: www.kiriindustries.com

xtract of Statement of Consolidated Financ	cial Results for the Quarter ar	d Half Year ende	d September 30, 2023
			(Rs. in Lakhs)
	Quarter	Ended	Half Year Ended
	(00/00/0000)	(00/00/0000)	(00/00/0000)

	Quarter Ended		Half Year Ended	
Particulars	(30/09/2023)	(30/09/2022)	(30/09/2023)	
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
Total income from operations	23,249.78	24,232.50	46,124.52	
Net Profit/ (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	(2,557.70)	(2,046.94)	(3,852.29)	
Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(2,557.70)	(2,046.94)	(3,852.29)	
Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(2,679.60)	(2,617.00)	(4,206.65)	
Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax)		0.005.07	1 005 17	
and Other Comprehensive Income (after tax)]	1,879.48	6,065.87	1,625.17	
Paid up Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.	5,183.42	5,183.42	5,183.42	
Earnings Per Share (Face value of Rs. 10/- each)		1	,	
Basic:	3.63	11.70	3.14	
Diluted:	3.63	11.70	3.14	

Future trem the Standalana Financial Populta for t	5.05	lalf Voor order	5.14 Contember 20, 2022	
Extract from the Standalone Financial Results for t	ne quarter and i	iait tear ended	(Rs. in Lakhs)	
	Quarter	Ended	Half Year Ended	
Particulars	(30/09/2023)	(30/09/2022)	(30/09/2023)	
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
Total income from operations	15,129.90	14,084.09	31,789.82	
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(3,500.86)	(4,412.68)	(3,732.49)	
Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(3,414.07)	(4,390.62)	(3,542.13)	

- 1. The above is an extract of the detailed Unaudited Quarterly Financial Results ("Results") filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on the website of Stock Exchanges (www.bseindia.com & www.nseindia.com) as well as on the Company's website (www.kiriindustries.com).
- 2. The Statutory Auditors of the company have carried out a "Limited Review" of the above results as per Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
- The above Results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on November 08, 2023.

By order of the Board of Directors For Kiri Industries Limited Manish Kir

Chairman & Managing Director

Date: November 08, 2023 Place: Ahmedabad











